

RAN-2508000605040004

T.Y.B.Com. (Sem. V) Examination March - 2026
Indian Banking & Currency Minor

[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) જમણી બાજુના અંક પ્રશ્નના પુરા ગુણ દર્શાવે છે. Figures to the right indicate full marks of that question. (3) પ્રશ્ન-૧ ફરજિયાત છે. Question no.1 is compulsory	Seat No.: <table border="1" style="width: 100%; text-align: center;"> <tr> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> </tr> </table> Student's Signature						

- પ્ર-1. ટુંકમાં ઉત્તર આપો. (ગમે તે પાંચ) 10**
- 1) બેંકની વ્યાખ્યા લખો.
 - 2) જાહેર ક્ષેત્રની બેન્ક એટલે શું?
 - 3) મર્યન્ટ બેંકિંગની વ્યાખ્યા આપો.
 - 4) થાપણ વીમા અને ક્રેડિટ ગેરંટી યોજનાના હેતુઓ જણાવો.
 - 5) SEBI-સેબીની સ્થાપના શા માટે થઈ હતી?
 - 6) મ્યુચ્યુઅલ ફંડ એટલે શું?
 - 7) SWP એટલે શું?
- પ્ર-2. “દેશના આર્થિક વિકાસમાં બેન્કિંગ સંસ્થાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે” સમજાવો. 14**
- અથવા**
- પ્ર-2. અ) જાહેર ક્ષેત્રની બેંકોના કાર્યો સમજાવો. 07**
- બ) જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની બેંકો વચ્ચેનો તફાવત સમજાવો. 07**
- પ્ર-3. SEBI- સેબીની સત્તાઓ, વ્યવસ્થાતંત્રીય માળખું અને તેના કાર્યો વિસ્તારથી સમજાવો. 14**
- અથવા**
- પ્ર-3. અ) મ્યુચ્યુઅલ ફંડના કાયદાઓની ચર્ચા કરો. 07**
- બ) મ્યુચ્યુઅલ ફંડ અંગેના SEBI-સેબીના નીતિ નિયમો સમજાવો. 07**
- પ્ર-4. ટુંક નોંધ લખો. (ગમે તે ત્રણ) 12**
- 1) થાપણ વીમા અને ક્રેડિટ ગેરંટી યોજનાના ફાયદા.
 - 2) ભારતીય બેન્કોના પ્રકાર.
 - 3) જાહેર ક્ષેત્રની બેંકોના પ્રકાર
 - 4) SEBI-સેબીની રોકાણકારો માટેની માર્ગદર્શિકા.
 - 5) મ્યુચ્યુઅલ ફંડ્સના મુખ્ય પ્રકારો.

ENGLISH VERSION

Q.1.	Answer in brief (Any five)	10
1.	Write the definition of Bank.	
2.	What is meant by Public sector banks?	
3.	Give definition of Merchant banking.	
4.	State the objectives of Deposit Insurance and Credit Guarantee Scheme.	
5.	Why was SEBI established?	
6.	What is meant by Mutual funds?	
7.	What is meant by SWP.	
Q.2.	“The role of banking institutions is very important in Economic Development of the Country.” Explain.	14
	OR	
Q.2.	[A] Explain the functions of Public sector banks .	07
	[B] Explain the difference between Public sector banks and Private sector bank.	07
Q.3.	Explain in detail the Power, Organization structure and Functions of SEBI.	14
	OR	
Q.3.	[A] Discuss the advantages of Mutual funds.	07
	[B] Explain the rules of SEBI for Mutual Funds.	07
Q.4.	Write Short note (Any three)	12
1.	The Advantages of Deposit Insurance and Credit Guarantee Scheme	
2.	The types of Indian banks.	
3.	Advantages of Public sector banks.	
4.	Guidelines of SEBI for Investors.	
5.	The main types of mutual funds.	
